



તારીખ:

પ્રતિ,
કેન્દ્રિય કૃષિ મંત્રી,
ભારત સરકાર,

વિષય : સુરક્ષિત અન્નની બાહેંધરીની માગણી

માનનીય મંત્રીશ્રી,

ભારતીય નાગરિક તરીકે અમને ઝેરી રસાયણોથી મુક્ત (સુરક્ષિત) અન્ન મેળવવાનો સંવિધાનિક હક્ક છે અને તે ઉપલબ્ધ કરાવવાની ભારત સરકારની ફરજ છે.

આજે ભારતમાં જુદાં-જુદાં કારણોસર ઉત્પાદન સમયે જ કૃષિ ઉપજ ઝેરી રસાયણોથી પ્રદૂષિત થાય છે. મોટા પાયે થયેલ પ્રયોગો અને અનેક સંશોધનો દ્વારા પ્રમાણિત થયું છે કે ઝેરી રસાયણો અને કાયમી ધોરણે નુકસાન કરનાર જેનેટિકલી મોડીફાઇડ (જી. એમ.) બિયારણના વપરાશ વગર પણ આર્થિક રીતે ફાયદાકારક હોય એવી ઉત્પાદક ખેતી થઈ શકે છે.

આવી સેન્દ્રિય/ સજીવ ખેતી અને એન.પી.એમ. (પેસ્ટિસાઇડ વાપર્યા વગરની ખેતી) - જે ઝેરી રસાયણોથી મુક્ત હોય - તે પર્યાવરણને જાળવનારી, આરોગ્યવર્ધક, પાક પેદા કરનારી અને ખેડૂતોને વધારે ફાયદાકારક તેમ જ શાશ્વત સાબિત થઈ ચૂકી છે. છતાં આ પદ્ધતિને સરકાર તરફથી કોઈ પ્રકારનું પ્રોત્સાહન અથવા સહાય અપાતા નથી. ખરું જોતા વધુમાં વધુ ખેતરોમાં આ પ્રકારની સેન્દ્રિય - સજીવ - શાશ્વત ખેતી થવી જોઈએ.

એટલે જ અમારી માગણી છે કે સુરક્ષિત અન્ન ઉપલબ્ધ કરાવવા સરકારે નીચે મુજબના મુદ્દાઓનો સુનિશ્ચિતપણે અમલ કરવો જોઈએ ;

- નૈસર્ગિક અને સજીવ ખેતીના પ્રચાર અને પ્રસારને પ્રોત્સાહન આપવું. આ પદ્ધતિથી ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો માટે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી.
- સેન્દ્રિય ખેતપેદાશો ઉપભોક્તાઓને સહેલાઈથી અને વાજબી દરે મળી શકે તે માટે પ્રત્યેક ૫૦,૦૦૦ ની વસ્તી દીઠ આવી એક દુકાન શરૂ કરવી. રેશનીંગની વિતરણ વ્યવસ્થાનો આ માટે ઉપયોગ કરી શકાય.
- ગર્ભવતી મહિલાઓ, બાળકો અને સ્તનપાન કરાવતી મહિલાઓને સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ મારફતે ખોરાક અપાય છે તે ઝેરી રસાયણોથી મુક્ત - સુરક્ષિત હોય તેની કાળજી લેવી.
- જે જંતુનાશકો બીજા દેશોમાં પ્રતિબંધિત જાહેર કરાયા છે અને જેના વપરાશથી કેન્સર જેવી ખતરનાક બિમારીઓ થઈ શકે એવા તમામ જંતુનાશકો પર ભારતમાં પણ પ્રતિબંધ લાગુ કરવો અને ચુસ્તતાથી એનો અમલ કરવો.

આપનો વિશ્વાસુ,

હસ્તાક્ષર:

નામ:

ફોન નંબર:

ઈ-મેલ:

શહેર:

રાજ્ય: